

આંહજરત સ.અ.વ.ના સહાબા તો એવા ભાગ્યશાળી હતા કે જ્યારે પોતાની હાલત પર ચિંતન કરીને ચિંતિત થતા તો આપની સેવામાં ચાલ્યા જતા હતા અને પછી આંહજરત સ.અ.વ.ની પવિત્ર શક્તિના કારણો પોતાનો છલાજ કરી લેતા હતા પરંતુ આપણો તો આ ચિંતા કરતા પોતાની ઇબાદતો, દુઆઓ અને ક્ષમાયાચનાને હંમેશા અપનાવતા રહેવું જોઈએ અને તેના દ્વારા પોતાનું છલાજ કરતા રહેવું જોઈએ.

સારાંશ મુખ્યા જુમ્મા સેષ્ટના હજરત અકદસ અમિતુલ મોમિનીન ખલીફતુલ મસીહ અલ ખામિસ ઐયદહુલ્લાહ તાલાબ બિનસરિહિલ અઝીજ, તા.-22-07-2016 સ્થળ : મસ્જદ બેતુલ કુતુહ વડન.

તશહુદ તાઓઉજ તથા સુર : ફાતેહાની તિલાવત બાદ હુજુર અનવર ઐયદહુલ્લાહ તાલાબ બિનસરિહિલ અઝીજ એ ફરમાવ્યું :

હજરત મસીહ મૌઉદ અ.સ.ની મહેનત તથા સંઘર્ષની આદત અને શરીર તંદુરસ્ત રાખવા માટે આપનો શું નિયમ હતો તેનું વર્ણન કરતાં હજરત મુસ્લેહ મૌઉદ રઝી ફરમાવે છે કે આપ આગસુ ન હતા બલ્કે ખુબ મહેનતી હતા અને એકાંતના મોહિત હોવા છતાં પણ મહેનતથી ન ગભરાતા હતા અને ઘણી વખત એવું થતું કે આપને જ્યારે કોઈ મુસાફરીમાં જવું પડતું તો સવારીનો થોડો નોકરના હાથે આગળ રવાના કરી દેતા અને આપ ચાલતા વીસ પચીસ મીલની મુસાફરી કરીને મંજુલ સુધી પહોંચી જતા બલ્કે ઘણી વાર આપ ચાલતા જ મુસાફરી કરતા હતા અને સવારી પર ઓછા ચડતા અને આ ચાલતા મુસાફરી કરવાની આદત આપને આખી ઉમર સુધી હતી અને સીતેર વર્ષની ઉમરમાં જ્યારે કે અમુક બિમારીઓ આપને હતી તો પણ આપ દરરોજ હવા ખાવા માટે બહાર જતા અને ચાર પાંચ મીલ દરરોજ ફરી આવતા અને ઘણી વખત સાત મીલ ચાલતા ફરી લેતા હતા ઘડપણ પહેલાંની હાલત આપ બયાન ફરમાવતા હતા કે અમુક વાર સવારની નમાજ પહેલાં ઉઠીને ફરવા નીકળી પડતા હતા અને બટાલા સુધી પહોંચી જતા જે કાદિયાનથી લગભગ સાડા પાંચ મીલ પર એક ગામ છે, સવારની નમાજનો સમય થતો.

તો આ નમૂનો છે આપણા માટે ખાસ કરીને વાકફીને જુંદગી માટે જેમના હાથમાં જમાઅતની સેવાનું કામ છે જેમાં મુરબ્બીયાન પ્રથમ નંબરે છે કે પોતાનું શરીર તંદુરસ્ત રાખવા માટે કસરત અથવા ફરવાની નિયમ અનુસાર આદત બનાવે. જો ફરી નથી શકતા સમયની કમી હોવાના કારણો અથવા કોઈ પણ કારણ સર તો થોડો સમય કસરત માટે કાઢવો જોઈએ.

હુજુર અનવરે ફરમાવ્યું : અમારા મુરબ્બીયાન અને વાકફીને જુંદગીએ કોઈ પણ પ્રકારની કસરત જરૂર કરવી જોઈએ અને બીજા આ પણ્યાં દેશોમાં શરીર માટે હાનિકારક ખોરાક પણ ખુબ સાધારણ છે તેનાંથી બચતું જોઈએ. થોડું ઘણું ભોજન બનાવતા મુરબ્બીને આવળવું જોઈએ. આ માત્ર હું તમને જ નસિહત નથી કરતો બલ્કે હું સ્વયં પણ કસરત કરું છું નિયમ અનુસાર અલ્લાહના ફિલથી. આમ, આપણાને તંદુરસ્ત વાકફીને જુંદગી અને મુરબ્બીયાન જોઈએ આ પ્રમાણે તેમને આ વાતનો ખાસ ઘાલ રાખવો જોઈએ કે તેઓ પોતાના શરીરની તંદુરસ્તી ના હવાલાથી લાપરવાહી અને આળસ ન રાખે કેમ કે પોતાના કાર્યો સારી રીતે કરી શકે.

અમુક વાર અમુક લોકો ખુબ ચિંતા વ્યક્ત કરે છે કે અમારી નેકીની હાલત એક જેવી નથી રહેતી, ખુબ ચિંતા થાય છે આ ખુબ સારી વાત છે કે ઇન્સાન પોતાનું નિરીક્ષણ કરતો રહે કે આ હાલત જે મારામાં નેકીની કમીની છે એ કેમ થઈ અને આ ચિંતા થાય કે તે વધારે સમય સુધી ન રહે અને તેના છલાજની ચિંતા કરે. તો આમ આ સારી વાત છે પરંતુ અમુક વાર એવું પણ થાય છે કે આ કોઈ બૂરાઈ નથી હોતી બલ્કે નેકી વધારે નેકી અને ઓછી નેકીની જે હાલત

ઇ તે આવતી જતી રહે છે. આંહજરત સ.અ.વ. પાસે પણ એક વ્યક્તિત આવ્યો આપના એક સહાબી આવ્યા તેમણે કહ્યું કે હે રસૂલુલ્લાહ હું તો મુનાફિક છું હું જ્યારે આપની સભામાં બેસુ છું તો મારી હાલત બીજી હોય છે અને જ્યારે આપની સભામાંથી ઉઠીને ચાલ્યો જઉ છું તો મારી હાલત બીજી હોય છે. અર્થાત નેકી અને પવિત્ર દિલની હાલત તે નથી રહેતી જે આપની સોબતમાં છે. આંહજરત સ.અ.વ.એ ફરમાવ્યું કે એ જ તો મોમેનની નિશાની છે તમે મુનાફિક (દંભી) નથી.

હુલુર અનવરે ફરમાવ્યું આ વિચારણા હતી સહાબાની અને જ્યારે આ અહેસાસ થાય છે તો પછી ઇન્સાન દુઓ અને ક્ષમાયાચનાથી પોતાની હાલત સુધારવા તરફ ધ્યાન આપે છે.

આંહજરત સ.અ.વ.ના સહાબા તો એવા ભાગ્યશાળી હતા કે જ્યારે પોતાની હાલત પર ચિંતન કરીને ચિંતિત થતા તો આપની સેવામાં ચાલ્યા જતા હતા અને પછી આંહજરત સ.અ.વ.ની કુવ્યતે કુદસીના કારણે પોતાનો ઇલાજ કરી લેતા હતા પરંતુ આપણો તો આ ચિંતા કરતા પોતાની ઇબાદતો, દુઆઓ અને ક્ષમાયાચનાને હંમેશા અપનાવતા રહેવું જોઈએ અને તેના દ્વારા પોતાનું ઇલાજ કરતા રહેવું જોઈએ. જો આપણો ભમ પણ હોય તો તે ભમ પણ લાપરવાહીની તુલનામાં સારો છે કેમ કે અમુક વાર એવું થાય છે કે લાપરવાહી ખુદા તાલાથી દુર લઈ જાય છે. અને પછી ધીમે ધીમે દીનથી પણ આપણો દુર થઈ જઈએ છીએ પછી અયોગ્ય ઇલાજ રૂહાની બીમાર બની જાય છે. માટે આ પ્રમાણે ખુબ ધ્યાન આપવાની જરૂર હોય છે.

હજરત મુસ્લેહ મૌલિદ રજી એક વાર આ વિષય બયાન કરી રહ્યા હતા કે ખુશી અને ગમીનો તાલુક લાગણી સંવેદનથી થાય છે. દા.ત. જો કોઈના ઘરમાં લગ્ન છે તો તે આ લગ્નની ખુશી માટે જો દેવું કરવું પડે તો પણ તે કરીને આ ખુશી મનાવવાનો પ્રયત્ન કરે છે અને તેના સગા સંબંધી પણ આ ખુશીમાં સામેલ થાય છે પરંતુ જેનું તેનાથી કોઈ તાલુક નથી હોતું તેમના માટે તે વ્યક્તિની ખુશી મનાવવું અથવા તેના ખાનદાન વાળાનું ખુશી મનાવવું અથવા તેના સગા સંબંધીનું ખુશી મનાવવું અને તેનું તકલીફમાં નાખવું અથવા દેવું કરવું કોઈ હેસીયત નથી રાખવું. તેવી જ રીતે એક વ્યક્તિ પોતાના ખાનદાનનો પાલક હોય જો તે મરી જાય તો ઘરમાં એક માતમ હોય છે પરંતુ બીજા જેનું તેનાથી કોઈ તાલુક નથી તેનું મૃત્યું પામવું કોઈ હેસીયત નથી રાખવું. હજારો લોકો રોજ મરે છે પરંતુ જેને આપણો ઓળખતા નથી તેની જાણ થયા છતાં પણ આપણાને તેનો અહેસાસ નથી થતો જ્યારે કે જો કોઈ સગ સંબંધીમાંથી કોઈ મૃત્યુ પામ્યો હોય તો તેનો ખુબ અહેસાસ થાય છે હજરત મુસ્લેહ મૌલિદ રજી ફરમાવે છે કે આ લાગણીનો અજબ સિલસિલો છે તેના પર ચિંતન કરવાથી અજબ હકીકિત ખુલે છે એક વાત એક માટે ખુશીનો અવસર રાહતની એક ઘડી હોય છે પણ બીજા માટે માતમનો અસર રાખે છે.

ફરમાવે છે કે આ વિષય મને હજરત મસીહ મૌલિદ અ.સ.એ એક ફકરામાં સિખવાડયો હતો. ફરમાવે છે કે હજરત મસીહ મૌલિદ અ.સ. નિયમિત અખબાર વાંચતા હતા. આ પણ આપણા તે લોકો માટે જેમના હાથમાં દીનના કામોની જીમોદારી છે તેમાં એક આ પણ સબક છે કે તેમણે નિયમિત અખબાર વાંચવું જોઈએ અને નાની નાની ખબરો પણ જોઈ લેવી જોઈએ. આપ ફરમાવે છે કે આપ નિયમિત અખબાર વાંચતા હતા એક વાર ઇ.સ.૧૯૦૭ની વાત છે. અખબાર વાંચતા મને બોલાવ્યો “મહેમૂદ” કહે છે કે જ્યારે હું હાજર થયો તો આપે મને એક સમાચાર સંભળાવ્યા એક વ્યક્તિ જેનું મને નામ યાદ નથી મૃત્યુ પામી ગયો છે. હજરત મુસ્લેહ મૌલિદ રજી કહે છે કે તેના પર મારી હંસી નિકળી ગઈ અને મેં કહ્યું કે મારે શું. હજરત સાહેબે ફરમાવ્યું એના ઘરમાં તો માતમ છાયું હશે અને તમે કહો છો કે મારે શું. તેનું કારણ શું છે હજરત મુસ્લેહ મૌલિદ રજી ફરમાવે છે કે જેના જોડે કોઈ સંબંધ ન હોય તેના દુઃખનો અસર નથી થતો અને તેવી જ રીતે ખુશીની વાત છે તો તે ખુશીનો પણ અસર નથી થતો.

માટે આ વાતને યાદ રાખવી જોઈએ કે પોતાના સહાયકો અને તેમની ઔલાદો માટે ખાસ દુઆઓ કરવી જોઈએ. ખુશી અને ગમમાં તેમને મહેસુસ કરવું જોઈએ અને જમાઅતના લોકો માટે સાર્વજનિક રીતે પણ આપણી

ખુશી અને ગમના ઇજહાર થવા જોઈએ કેમ કે જમાઅત પણ એક વજૂદ છે અને તે સમયે અહેસાસ પૈદા થાય છે જ્યારે આપણો જમાઅતના લોકોના દુઃખને ખુશીને મહેસુસ પણ કરીએ આ એક વસ્તું છે જે જમાઅતમાં એકતા પૈદા કરવાનું કારણ છે.

પછી અમુક લોકો જમાઅતી તૌર પર વાંધો વિરોધ ઉઠાવે છે દા.ત. કોઈને સજા મળી છે અથવા કોઈ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થઇ છે તો તે કહે છે કે મારા વિરુદ્ધ જે ફલાણી કાર્યવાહી થઇ છે તે ખોટી છે અને ફલાણા વ્યક્તિ વિરુદ્ધ નથી થઇ અને તેની તરફદારી કરી છે. આ પ્રકારના વાંધા વિરોધ કોઈ નવી વાત નથી. પ્રત્યેક યુગમાં એવા વાંધા વિરોધ મળે છે આજે પણ કરે છે પહેલાં પણ કરતા હતા. માટે એવા લોકોનું વર્ણન કરતાં હજરત મુસ્લેહ મૌલિક રજી ફરમાવે છે કે

વાસ્તવિકતા એ છે કે નિઝામની દુરુસ્તી માટે વિચારોમાં સમાનતાનો એક દાયરો હોય છે હોઈ શકે છે કે એક મતભેદ મોટો દેખાય પરંતુ જો તે કોઈ ફિલ્નાનું કારણ નથી તો તે મતભેદ રાખનારે જમાઅતમાં સામેલ થવાની પરવાનગી આપી દેવામાં આવે પરંતુ એક બીજો વ્યક્તિ ભલેને તેનાથી ઓછું મતભેદ રાખતો હોય પણ જો તેનો મતભેદ કોઈ ફિલ્નાનું કારણ હોય તો તેને જમાઅતમાંથી કાઢી નાખવામાં આવે. ફરમાવે છે કે હજરત મસીહ મૌલિક અ.સ.થી એક વાર એક દોસ્તે પુછ્યું કે હું હમણાં શિયા ફિર્કાથી નીકળીને આવ્યો હું અને હજરત અલી રજીને હજરત અખુબકર રજી અને હજરત ઉમર રજીથી અફ્ગલ સમજું હું કેમ કે મારામાં શિય ફિર્કાનો અસર વધારે છે. માટે શું આ અકીદો હોવા છતાં હું આપની બૈઅત કરી શકું છું. હજરત મસીહ મૌલિક અ.સ.એ તેમને લખ્યું કે આપ બૈઅત કરી શકો છો પરંતુ તેના મુકાબલામાં હજરત મસીહ મૌલિક અ.સ.એ એક વાર કેટલાંક લોકોને કાહિયાનથી બહાર ચાલ્યા જવાનો આદેશ આપ્યો સજાના રૂપમાં અને તેમના વિશે જાહેરાત પણ આપી કારણ માત્ર એ હતું કે તેઓ પાંચ સમયની નમાજમાં હાજર ન રહેતાં હતા અને અમુક એવા હતા કે તેમની સભાઓમાં હુક્કાપીનાર અને કુજુલ ચર્ચામાં રહેતા હતા. આમ આપે તે વસ્તું જે આ પ્રકારનું પ્રતિબંધ નથી રાખતું જેવું કે મહિરા સેવન પોતાની અંદર રાખે છે પ્રયોગ કરવા પર એક વ્યક્તિને જમાઅતમાંથી ખારિજ કરી દીધો અને તે જેણો કહ્યું કે હજરત અખુબકર રજીની તુલનામાં હજરત અલી રજીને અફ્ગલ સમજું હું તે છતાંય કે હજરત મસીહ મૌલિક અ.સ.ની પોતાની આસ્થા એ હતી કે હજરત અખુબકર રજી, હજરત અલી રજીની અપેક્ષા ઉત્તમ છે તેને બૈઅત કરવાની અનુમતી આપી દીધી. આપ ફરમાવે છે કે વાસ્તવમાં અમુક વાતો કોઈ સમયે ઉપદ્રવની સંભાવનાને કારણ મોટી હોય છે જ્યારે કે અમુક વાતો કોઈ સમયે ઉપદ્રવની દ્વારાથી નાની હોય છે જ્યારે કે વાસ્તવમાં તે મોટી હોય છે.

ક્ષણિક ઉપદ્રવની દ્વારાથી કયારેક મોટી વાતને નજર અંદર કરી દેવામાં આવે છે તથા નાની વાત પર એકશન લઇ લેવામાં આવે છે પરંતુ તે લોકો જે વાંધો ઉઠાવનાર છે કદાપી અકલથી કામ નથી લીધું તેમનો હેતુ માત્ર વાંધો ઉઠાવવો છે અમુક સમર્થક પૈદા થાય છે તેમના, જેને સજા મળે છે તેમને માલૂમ નથી હોતું કે વાસ્તવિકતા શું છે, કયાં કારણે સજા મળે છે. તો આ વિષયમાં અકારણ હસ્તક્ષેપ ન કરવું જોઈએ અથવા કોઈની સિફારશ ન કરવી જોઈએ. હાં જ્યારે નિઝામ સમજે છે, નિરીક્ષણ કરવામાં આવે છે તો પછી તેમની માફી પણ થાય છે. આ પ્રકારના આપત્તિકર્તા, જેવું કે મેં કહ્યું કે આજકાલ પણ છે. અનુચ્છિત કામ કરે છે, સજા મળે તો સુધારની જગ્યાએ જમાઅતની વિરુદ્ધ બોલે છે અને એ પણ માંગ હોય છે કે અમે જેવા છીએ તેવા જ રહીશું, તે છતાંય જમાઅતનો નિઝામ અમોને પોતાનું અંગ બનાવે, અમારે સુધાર નથી કરવો.

હજરત મુસ્લેહ મૌલિક રજીએ એક વાર બાળકોના પ્રશિક્ષણ માટે એક નિબંધ લખ્યો જેમાં હજરત મસીહ મૌલિક અ.સ.ની એક વાતાનું વર્ણન કર્યું. આપ લખો છો કે ઇમામ અ.સ.એ ૫ સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૮૮ ના રોજ અસરની નમાજ બાદ મારા નિવેદન પર મને દર્શાવેલ વાર્તા સંભળાવી જેનાથી માલૂમ થાય છે કે અલ્લાહ તાલા પર પૂર્વ વિશ્વાસ અને ભરોસો કરવું તથા સાચો તકવા ઇન્સાનને એ યોગ્ય બનાવી દે છે કે ખુદા તાલા સ્વયં તેનો

અભિભાવક થઈ જાય છે અને એવા માર્ગાથી તેની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે કે કોઈને ખબર પણ નથી પડતી. અર્થાત હજરત મસીહ મૌલિક અ.સ.એ ફરમાવ્યું કે એક આદરણીય વ્યક્તિત્વ ક્યાંક યાત્રા પર જઈ રહ્યા હતા અને એક જુંગલમાંથી તેઓ પસાર થયા, જ્યાં એક ચોર રહેતો હતો અને તે પ્રત્યેક આવનાર જનારને લુટી લેતો હતો. પોતાની પ્રવૃત્તિ અનુસાર તે આદરણીય વ્યક્તિને પણ લુટવા લાગ્યો. તે વ્યક્તિએ તેને ફરમાવ્યું કે આસ્માનથી તારો રિઝક છે અને જેનો તમે વાયદો આપવામાં આવે છે કે તમે નેકીઓ પર કાયમ રહો. ફરમાવ્યું કે તમારું રિઝક આસ્માન પર ઉપલબ્ધ છે તમે ખુદા પર ભરોસો રાખો અને તકવા ધારણ કરો, ચોરી છોડી દો, ખુદા તાદ્વાલા સ્વયં તમારી આવશ્યકતા પૂર્ણ કરી દેશો. છોરના દિલમાં પ્રભાવ થયો, તેણો તે બુજુર્ગને છોડી દીધો તથા તેમના કહેવા અનુસાર કામ કર્યું ત્યાં સુધી કે સોના ચાંદીના વાસણોમાં તેને ઉમદા ઉમદા ભોજન મળવા લાગ્યા. ક્યાં તે ચોરીઓ કરતો હતો અને જ્યાંરે ચોરી છોડી દીધો અને અલ્લાહ તાદ્વાલા પર ભરોસો રાખ્યો તો સોના ચાંદીના વાસણોમાં તેને ભોજન મળવા લાગ્યું. ટો ભોજન કરીને વાસણો ઝુંપડીની બહાર ફેંકી દેતો હતો. સંયોગવશ તે જ બુજુર્ગ ફરીથી ત્યાંથી ગુજર્યા તો તે ચોરે જે હવે ખુબ મુત્તકી થઈ ગયો હતો તે બુજુર્ગને પુરી હાલત બયાન કરી અને કહું કે મને કોઈ બીજી આયત બતાવો તો બુજુર્ગ સાહેબ ફરમાવ્યું કે આસ્માન અને જમીનના રબના સોંગંદ, ખરેખર આ હક છે. આ પવિત્ર શબ્દો સાંભળીને તેના પર એવો પ્રભાવ પડ્યો કે ખુદા તાદ્વાલાની મહાનતા અને પ્રતાપનું ધ્યાન કરીને તડપી ઉઠ્યો અને તેમાં જ જીવ આપી દીધો. તો આ આઈ દસ વર્ષના બાળકને વાર્તા સંભળાવી હજરત મસીહ મૌલિક અ.સ.એ અને પછી તે આગળ બાળકોને આ કહી રહ્યા છે પોતાના નિબંધમાં કે તકવા ધારણ કરવાથી કેવી દૌલત મળે છે કે ખુદા તાદ્વાલા જે ધરતી અને આકાશના રહેનારનું પાલન પોષણ કરે છે, શું તેના હોવામાં કોઈ સંદેહ છે. તે પાક અને સાચો ખુદા છે જે આપણું પાલન પોષણ કરે છે. માટે તે ખુદાથી ડરો, તેના પર ભરોસો કરો અને નેક ચલન ધારણ કરો. આ હજરત મસીહ મૌલિક અ.સ.ના યુગના બાળકોની દશા હતી કે તેમને શિક્ષણ આપવામાં આવતું હતું જે આજ કાલના મોટા લોકોને સમજવામાં પણ કઠિન છે. પ્રત્યેક હંમેશા યાદ રાખવું જોઈએ કે તકવા પર ચાલવાનો પ્રયાસ કરે તથા અલ્લાહ તાદ્વાલાના અસ્તિત્વ પર એટલો વિશ્વાસ હોય કે તે જ છે જે આપણું ભરણ પોષણ કરે છે અને તેમાં કોઈ સંદેહ નથી કે તે પાક અને સાચો ખુદા છે તથા તેનાથી આપણો ડરવું જોઈએ, અને તેનાથી જ આપણો દુઆઓ માંગવી જોઈએ અને તેની સામે જ ઝુકવું જોઈએ અને તેના પર જ ભરોસો રાખવો જોઈએ અને આ જ નેકી છે જે એક મુસિલિમને ધારણ કરવી જરૂરી છે તથા જેના પર ઇમાન લાવવું જરૂરી છે અને જેના અનુસાર કાર્ય કરવું જરૂરી છે.

માટે આ શિક્ષણાની બાળકો કરતાં મોટા માટે વધારે મહત્વની છે આજ કાલના યુગમાં જ્યારે આપણો આ વાતોને ભુલતા જઈ રહ્યા છીએ અને તકવાથી અમુક લોકો દુર થઈ જાય છે અલ્લાહ પર ભરોસો કરવાને બદલે લોકો પર ભરોસો વધારે કરે છે તેમણે યાદ રાખવું જોઈએ કે વાસ્તવિક ભરોસો ખુદા તાદ્વાલાના અસ્તિત્વ પર હોવો જોઈએ. અલ્લાહ કરે કે આપણામાં આ તકવા પૈદા થાય. આમીન.

Khulasa Khutba Jumma Huzoor Anwar 22 July 2016

BOOK POST (Printed Matter)

To,.....

.....

.....

From: Masroor Manzil, Al-Aman soc. Narol, Ahmedabad-382405 Gujarat.